https://archive.org/details/bk797/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar
tidar.com

અખીલ ભારતીય ક.ક. પાટીદાર સનાતન ધર્મ જાગૃતિ સમિતિ, ધનસુરા

Full Library on https://realpatidar.com/library

કેન્દ્રીય સમાજની સમાધાન સમિતિનું જ્ઞાતિજનો જોગ નમ્ર નિવેદન ને સનાતન ધર્મ જાગૃતિ સમિતિ નો સચોટ જવાબ

તા. ૧૨-૧૨-૨૦૦૯

વ્હાલા જ્ઞાતિજનો,

આથી આપ સૌને વાકેફ કરવામાં આવે છે કે અ.ભા.ક.ક.પાટીદાર સમાજ દ્વારા રચાયેલ કહેવાતી સમાધાન સમિતિનું ઉમા દર્પણ અને પાટીદાર સંદેશના તાજેતરના અંકમાં છપાએલ જ્ઞાતિજનો જોગ એક નમ્ર નિવેદન સચ્ચાઈ થી વિરુધ્ધ સમગ્ર કચ્છ કડવા પાટીદારોને ગુમરાહ કરવાનો તથા પોતાની નબળાઈઓ છુપાવવા માટેનો એક હીન પ્રયાસ છે.

નીચે જણાવેલ મુદ્દાઓ અને સત્ય હકિકતોનો આપ સૌ જ્ઞાતિજનો ઉંડાણથી અભ્યાસ કરશો તો તમોને જણાઈ આવશે કે આપણી કેન્દ્રીય સમાજના આજના ધુરીણો પોતાની નબળાઈઓ છુપાવવા સત્યથી વિરૂદ્ધ જઈ આવા ખોટા નિવેદનો છપાવે છે.

૧. સમાધાન સમિતિ જ્ઞાતિમાં જુઠાણું ફેલાવે છે કે સમાજમાં સાંપ્રદાયિક મતભેદ પણ ઉભરી રહ્યા છે. સંપ્રદાય એટલે શું? હા, સમાજમાં સનાતન હિન્દુ ધર્મ હેઠળ અનેક સાંપ્રદાયો જેવાં કે સ્વામીનારાયણ સંપ્રદાય, લક્ષ્મીનારાયણ સંપ્રદાય અથવા તો આર્ય સમાજી સંપ્રદાય. પણ સતપંથ એ કાંઈ હિન્દુ ધર્મનો સંપ્રદાય નથી. ઇન્ટરનેટ ઉપર અસંખ્ય પુરાવાઓ મોજુદ છે, તેમાં નિશંકપણે પુરવાર થયેલું છે કે પિરાણા સતપંથ એક ઇસ્લામ ધર્મનો શિયા પંથ હેઠળ નિઝારી, અને તેના હેઠળનો સતપંથ એક મુસ્લીમ ધર્મનો સંપ્રદાય છે. તેથી જ તો આપણા જ્ઞાતિ સુધારકો, જેવા કે શ્રી નારાયણ રામજી લીંબાણી, શ્રી રતનશી ખીમજી ખેતાણી, શ્રી કેશરા પરમેશ્વરા, શ્રી પરબત લખુ પોકાર. શ્રી ભીમજી કેશરા લીં[illegible]ણી વગેરે અનેક [illegible]

....2

realpatidar.com

https://archive.org/details/bk797/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk797/page/n2/mode/1up

realpatidar.com

અખીલ ભારતીય ક.ક. પાટીદાર સનાતન ધર્મ જાગૃતિ સમિતિ, ધનસુરા

કેન્દ્રીય સમાજની સમાધાન સમિતિનું જ્ઞાતિજનો જોગ નમ્ર નિવેદન ને સનાતન ધર્મ જાગૃતિ સમિતિ નો સચોટ જવાબ

તા. ૧૨-૧૨-૨૦૦૯

વ્હાલા જ્ઞાતિજનો,

આથી આપ સૌને વાકેફ કરવામાં આવે છે કે અ.ભા.ક.ક.પાટીદાર સમાજ દ્વારા રચાયેલ કહેવાતી સમાધાન સમિતિનું ઉમા દર્પણ અને પાટીદાર સંદેશના તાજેતરના અંકમાં છપાએલ જ્ઞાતિજનો જોગ એક નમ્ર નિવેદન સચ્ચાઈ થી વિરુધ્ધ સમગ્ર કચ્છ કડવા પાટીદારોને ગુમરાહ કરવાનો તથા પોતાની નબળાઈઓ છુપાવવા માટેનો એક હીન પ્રયાસ છે.

નીચે જણાવેલ મુદ્દાઓ અને સત્ય હકિકતોનો આપ સૌ જ્ઞાતિજનો ઉંડાણથી અભ્યાસ કરશો તો તમોને જણાઈ આવશે કે આપણી કેન્દ્રીય સમાજના આજના ધુરીણો પોતાની નબળાઈઓ છુપાવવા સત્યથી વિરૂદ્ધ જઈ આવા ખોટા નિવેદનો છપાવે છે.

૧. સમાધાન સમિતિ જ્ઞાતિમાં જુઠાણું ફેલાવે છે કે સમાજમાં સાંપ્રદાયિક મતભેદ પણ ઉભરી રહ્યા છે. સંપ્રદાય એટલે શું? હા, સમાજમાં સનાતન હિન્દુ ધર્મ હેઠળ અનેક સાંપ્રદાયો જેવાં કે સ્વામીનારાયણ સંપ્રદાય, લક્ષ્મીનારાયણ સંપ્રદાય અથવા તો આર્ય સમાજી સંપ્રદાય. પણ સતપંથ એ કાંઈ હિન્દુ ધર્મનો સંપ્રદાય નથી. ઇન્ટરનેટ ઉપર અસંખ્ય પુરાવાઓ મોજુદ છે, તેમાં નિશંકપણે પુરવાર થયેલું છે કે પિરાણા સતપંથ એક ઇસ્લામ ધર્મનો શિયા પંથ હેઠળ નિઝારી, અને તેના હેઠળનો સતપંથ એક મુસ્લીમ ધર્મનો સંપ્રદાય છે. તેથી જ તો આપણા જ્ઞાતિ સુધારકો, જેવા કે શ્રી નારાયણ રામજી લીંબાણી, શ્રી રતનશી ખીમજી ખેતાણી, શ્રી કેશરા પરમેશ્વરા, શ્રી પરબત લખુ પોકાર. શ્રી ભીમજી કેશરા લીં[illegible]ણી વગેરે અનેક [illegible]ના

....2

realpatidar.com

https://archive.org/details/bk797/page/n3/mode/1up

realpatidar.com

એ સમય સમય પર આપણી જ્ઞાતિને જાગૃત કરી **અર્ધદગ્ધ પિરાણા સતપંથ કબ્રસ્તાની પંથનો ત્યાગ કરાવ્યો. ફળશ્રુતિએ આજની આપણી કેન્દ્રીય સમાજની સ્થાપના થઈ.** આજે સમાજમાં સાંપ્રદાયિક ઝગડા નથી પણ વિધર્મીઓ સાથેના ઝગડાઓ છે. એક સમાજમાં વિધર્મીઓ કોઈ દિવસ સાથે રહી જ ન શકે. જ્ઞાતિજનો એક વાત યાદ રાખો કે આપણા સનાતન ધર્મના સાંપ્રદાયો જેવા કે સ્વામીનારાયણ સાંપ્રદાય, લક્ષ્મીનારાયણ સાંપ્રદાય અથવા તો આર્ય સમાજીઓ વચ્ચે સમાજમાં કોઈ દિવસ ઝગડા થયા જ નથી. ફક્ત સતપંથીઓ જોડે જ ઝગડા અને મતભેદો શા માટે થાય છે? કારણ કે તેની સ્થાપના ઇસ્લામ ધર્મના પાયા પર થઈ છે.

૨. કેન્દ્રીય સમાજ એમ કહેવા માંગે છે કે સ્વ. શ્રી નારાયણ રતનશી છાભૈયા ને કેસો ના ઉકેલ માટે જવાબદારીઓ સોંપી હતી અને ૨૦૦૯ માં બે-ત્રણ મીટિંગો કરી હતી. પણ ખરેખર આ વાતમાં ખરી હકિકત એ છે કે જે સનાતની ભાઈઓ પર કેસો થયેલા છે તેમને તો બોલાવવામાં આવેલ જ નથી. તેના પુરાવાઓ મોજુદ છે અને જે માણસ આજે આપણી વચ્ચે હાજર જ નથી એને કેન્દ્રીય સમાજ લોકોમાં એમ ઠસાવે કે તેઓને જવાબદારી સોંપાયેલ હતી, તે કેટલું હાસ્યાસ્પદ કહેવાય! કારણ કે આવી જવાબદારીઓની જાણ જેના ઉપર કેસો થયા છે તેમને કરવામાં આવી જ ન હતી. અમુક કેસો તો ૨૦૦૬ ની સાલમાં થયેલા છે તેવા લોકોને તો જાણ જ કરવામાં આવી નથી તો સ્વ. શ્રી નારાયણ રતનશી છાભૈયા ને કયા કેસો ના ઉકેલ માટે જવાબદારીઓ સોંપવામાં આવી હતી તે એક પ્રશ્ન જ રહી જાય છે કારણ કે સ્વ. શ્રી નારાયણભાઈ પોતે જ આ દુનિયામાં નથી.

૩. સમાધાન સમિતિ જ્ઞાતિજનોને ગુમરાહ કરતાં જણાવે છે કે તા. ૪-૮-૨૦૦૯ ના રોજ સનાતની ભાઈઓ દ્વારા સાંપ્રદાયિક મતભેદ અંગેનો પત્ર મળ્યો. ભલા માણસ, એ સાંપ્રદાયિક મતભેદ અંગેનો પત્ર ન હતો તે ધાર્મિક મતભેદો અંગેનો પત્ર હતો કારણ સતપંથ એ સનાતન ધર્મનો સંપ્રદાય નથી, તે એક ઇસ્લામ ધર્મનો ફાંટો છે એટલે જ એવા વિધર્મીઓનો સમાજમાં સમાવેશ કરી જ ન શકાય. અનેક હિન્દુઓને વટલાવવા માટે થઈને જવાબદાર માણસ મુસ્લીમ પીર ઇમામશાહ ના નામે [illegible] કહેવાતા મંદિરો ના ઉદ્‌ઘાટન સમારોહમાં કેન્દ્રીય સમાજના ટ્રસ્ટીઓ, [illegible]રો તેમજ તેમના સહયોગીઓ જતા હોય તો તેઓ સમાજની બંધારણીય [illegible] નૈતિક અને ભાવનાત્મક દષ્ટિએ ગુનેગાર ઠરે જ છે.

realpatidar.com

realpatidar.com

આવા ગુનેગારોમાં ના એક એવા વરીષ્ઠ ટ્રસ્ટી શિવદાસ ગોવિંદ છાભૈયા ને જ આ કેન્દ્રીય સમાજ સમાધાન સમિતિના આગેવાન બનાવતી હોય તો તેઓશ્રી કેવો ન્યાય કરે તેમ જ કઈ રીતે પ્રશ્નોનો ઉકેલ લઈ આવે? વાહ રે વાહ! કેન્દ્રીય સમાજની આવી નીતિને વાહ. તા. ૫-૮-૨૦૦૯ ની રાત્રીની મીટિંગમાં ટ્રસ્ટીશ્રીઓએ અને હોદ્દેદારોએ ઉપરોક્ત ગુનો કબૂલ પણ કર્યો હતો. સમાધાન સમિતિ એ પણ લખે છે કે સામાન્ય સભામાં સનાતની ભાઈઓ તરફથી પત્ર વાંચવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. તેમાં ખોટું પણ શું છે? કારણ કે આવેલ પત્રોનું વાંચન કરવું એવો સમાજની સામાન્ય સભાનો બીજા નંબરનો એજન્ડા હતો જ. ઉલટાનું તે એજન્ડા બીજા નંબરમાં હોવા છતાં તેને જાણી જોઈને છેલ્લે લઈ ગયા કે જેથી તે ટપાલ પર જોઈએ તેટલી બહેસ એવમ્ ચર્ચા ન થઈ શકે.

૪. સમાધાન સમિતિ એ પણ આરોપ લગાવે છે કે પત્રના વાંચન બાદ એના પર અશોભનીય ભાષામાં ઉગ્ર રજુઆતો કરવામાં આવી જેને લઈને વાતાવરણ દૂષિત થયું. આ આરોપો તદ્દન પાયા વિહોણા છે અને તેમાં બિલકુલ વજૂદ નથી. કેન્દ્રીય સમાજના છેલ્લા ૫૦ વર્ષના ઈતિહાસમાં આટલી સ્પષ્ટ અને સચોટ રજુઆત થવાના કોઈ જ દાખલા નથી. સાચી અને સ્પષ્ટ રજુઆત થકી સભામાં PIN DROP SILENCE હતી. હાજર લોકોમાં સચોટ માહિતી અને વિગતો જાણવા માટે કુતુહલતા અને આતુરતા નજરે પડતી હતી. વાતાવરણ બિલકુલ દૂષિત નોતુ થયું. વાતાવરણ તો એવા લોકો દૂષિત કરી રહ્યા છે કે જેઓ બધું જાણવા છતાં ધાર્મિક બાબતોમાં અજાણ છે તેવો દંભ કરી રહ્યા છે તેથી જ તો કેન્દ્રીય સમાજના મુળભુત ઉદ્દેશો તેમજ હેતુઓને કેટલું નુકસાન થઈ રહ્યું છે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. સમાજના સનાતન ધર્મને વરેલા લોકોને એ પણ ભય છે કે આજના કેન્દ્રીય સમાજના આગેવાનોની બેવડી અને અસ્પષ્ટ નીતિને લીધે કેન્દ્રીય સમાજની મૂળ સનાતની તરીકેની ઓળખ પર પણ કુઠારાઘાત થઈ રહ્યા છે અને તેથી સમયસર આપણે જ્ઞાતિજનો ચેતશું નહીં તો કેન્દ્રીય સમાજની સનાતની તરીકેની સાચી ઓળખ પણ મટી જશે - તેનું નામો-નિશાન નહીં રહે.

૫. કેન્દ્રીય સમાજ એ પણ કહે છે કે સમાજ દ્વારા નિયુક્ત સમાધાન સમિતિએ પોતાનું કાર્ય શરૂ પણ કરી દીધું છે. પણ આ સમાધાન સમિતિનું ગઠન કેવું છે અને કોણે તે ગઠન કર્યું છે તેનાથી તો આમ જ્ઞાતિજનો તેમજ સનાતન ધર્મ જાગૃતિ સમિતિ પણ તદ્દન અજાણ છે. સમાજમાં

....4

realpatidar.com

realpatidar.com

ન્યાય સમિતિનું ગઠન પહેલેથી મોજુદ જ છે. તેના હાલના વડા મુરબ્બી ભાઈ શ્રી કરશનભાઈ લધા દિવાણી, હૈદરાબાદવાળા છે જ. અ.ભા.ક.ક. પાટીદાર સમાજ જ્ઞાતિ રીત રિવાજો ને લગતા નિયમો પૈકી ઠરાવ કલમ નંબર ૧૯ મુજબ,

'સમાજમાં ઉપસ્થિત થતાં ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સમાજ લેવલે નિરાકરણ લાવવા માટે અલગ પેટા નિયમો સાથેની કેન્દ્રીય સામાજીક ન્યાય સમિતિ ની નિમણુંક કરવામાં આવેલ છે. તેથી સામાજીક તેમજ ધાર્મિક પ્રશ્નો બાબત સ્માજમાં મતભેદ ઉભા થાય તેવા સંજોગોમાં તેનો નિકાલ સામાજીક ન્યાય સમિતિ દ્વારા કરવો અને તે નિર્ણય અંતિમ રહેશે.'

આવું સ્પષ્ટ માળખું તૈયાર હોવા છતાં પણ કેન્દ્રીય સમાજને ન્યાય સમિતિથી તદ્દન જુદી સમાધાન સમિતિની રચના શા માટે કરવી પડી? શું તેમને ન્યાય સમિતિના વડા આગેવાન ભાઈ શ્રી કરશનભાઈ લધા દિવાણી અને તેમના સહયોગિઓની કાબેલીયત પર કોઈ શંકા હતી કે પછી કોઈ બીક લાગી ગઈ કે જેથી તેમના પર પરોક્ષ રીતે અવિશ્વાસ દર્શાવી નવી સમાધાન સમિતિનું ગઠન કરવું પડે! જેથી તેમાં બન્ને બાજું ઢોલ વગાડતા હોય તેવા ટ્રસ્ટીઓ અને આગેવાનોને લઈ શકાય જેથી એક પક્ષીય અને પોતાને અનુકૂળ એવો ન્યાય કરી શકે. એટલું જ નહી, આ સમાધાન સમિતમાં કેન્દ્રીય સામાજીક ન્યાય સમિતિના પ્રમુખ અને મંત્રીશ્રી ને પણ ન લેવાયા તે તો એક હાસ્યાસ્પદ ઘટના જ ગણી શકાય. **It is a height of Kendriya Samaj's Intellectual Insolvancy and also it is shameful act on the part of Kendriya Samaj to treat members of the NYAY SAMITI as mere DIRT.**

શું આગેવાન વડીલ શ્રી કરશનભાઈ લધા દિવાણી ફક્ત છુટાછેડા સમિતિના વડા છે? શું તેમને અને તેમના સહયોગીઓને ધાર્મિક પ્રશ્નો અંગે ન્યાય કરતાં નથી આવડતું? જો એમ હોય તો તેમની ન્યાય સમિતિનું નામ બદલી કેન્દ્રીય છુટાછેડા સમિતિ એવું નામ આપવું યથાર્થ ગણાશે.

૬. સમાધાન સમિતિ સનાતની ભાઈઓ ઉપર એ પણ આરોપ લગાવે છે કે તા. ૮-૧૦-૨૦૦૯ ની મીટિંગમાં સનાતની ભાઈઓ આવ્યા નહી અને તેથી કરીને સમાધાનની

realpatidar.com

realpatidar.com

કાર્યવાહીમાં વિલંબ થયો. જરા જુઓ તો ખરા કે ઉપર જણાવ્યા પ્રમાણે આ સમાધાન સમિતિનું ગઠન જ વિવાદાસ્પદ હોય તેવાની સાથે વાર્તાલાપ કરવો કેટલો યથાર્થ અને અસરકારક ગણાય? છતાં પણ સનાતની ભાઈઓની ૪-૧૦-૨૦૦૯ ના ધનસુરા ખાતે મીટિંગ હોવાથી તા. ૮-૧૦-૨૦૦૯ ના અમારાથી પહોંચી નહી શકાય એવું સમાધાન સમિતિના મંત્રી શ્રી કાંતિભાઈ સેંઘાણીને સનાતની ભાઈ શ્રી હિમ્મતભાઈ ખેતાણીએ રૂબરૂ અને ફોન ઉપર વાત કરી હતી. તેથી આ આક્ષેપ પણ તદ્દન પાયા વિહોણો અને જ્ઞાતિજનોને ગેરમાર્ગે દોરવા માટેનો જ આક્ષેપ છે.

૭. કેન્દ્રીય સમાજની કહેવાતી સમાધાન સમિતિ જ્ઞાતિજનો ને ગુમરાહ કરવા માટે એ પણ નિવેદન કરતા અચકાતી નથી કે તા. ૧૧-૧૧-૨૦૦૯ ના સમાધાન સમિતિ વચ્ચે અને સનાતન ધર્મ જાગૃતિ સમિતિ વચ્ચે સંપૂર્ણપણે સમાધાન કરવામાં આવ્યું છે. આ નિવેદન તો તદ્દન જુઠું, પાયા વિહોણુ અને જ્ઞાતિજનોને ગેરમાર્ગે દોરે એવું છે. કારણ કે આ ઉપરોક્ત મીટિંગમાં સનાતની ભાઈઓએ મુખ્યત્વે બે વાતો પર જોરદાર રજુઆત કરેલી.

એક વાત એ હતી કે સ્વર્ણીમ મહોત્સવ પહેલાં સનાતની ભાઈઓ ઉપર થયેલા તમામ કેસો પાછા ખેંચી લેવા બાબત અને

બીજી વાત એ હતી કે આપણી આજની કેન્દ્રીય સમાજની સ્થાપના અર્ધદગ્ધ પિરાણા સતપંથ કબ્રસ્તાની મતને તિલાંજલી આપી સનાતન ધર્મને વરેલા વડીલો દ્વારા કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ એ જ હતો કે આપણી જ્ઞાતિમાંથી પિરાણા સતપંથનો સંપૂર્ણપણે નાશ કરવો અને સમગ્ર જ્ઞાતિને આપણા મૂળ સનાતન ધર્મ એટલે કે મૂળ હિન્દુ ધર્મના પ્રવાહ સાથે જોડવી.

ઉપરોક્ત બે મુખ્ય વાતો પર હજી સુધી કોઈ જ સમાધાન કરવામાં આવ્યું નથી. કેન્દ્રીય સમાજના આજના આગેવાનો ફક્ત પોતાની અક્ષમતા ઉપર ઢાંક પિછોડો કરવાના હેતુથી આવા ખોટા અને પાયા વિહોણા, જ્ઞાતિજોગ નિવેદનો કરી રહ્યા છે. જેનાથી અ.ભા.ક.ક. પાટીદાર સનાતન ધર્મ જાગૃતિ સમિતિ સમસ્ત જ્ઞાતિજનોને નમ્ર નિવેદન અને વિનંતી કરે છે કે કેન્દ્રીય સમાજના આવા નિવેદનો ઉપર વિશ્વાસ ન રાખતાં આપણી કેન્દ્રીય સમાજની

realpatidar.com

....6

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk797/page/n7/mode/1up

realpatidar.com

સ્થાપના

૧. કયા સંદર્ભોમાં કયા વડીલોના અથાગ પરિશ્રમથી થઈ?
૨. સ્થાપના વખતેના તેના મૂળભુત ઉદ્દેશો શું હતા?
૩. સ્થાપના વખતેના તેના હેતુઓ શા હતા?
૪. પિરાણા સતપંથ થી અલગ થઈને આ નવી સમાજની સ્થાપના આપણા વડીલોને શા માટે કરવી પડી હતી?

આવી બાબતોનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવશે તો તમોને સંપૂર્ણ ખ્યાલ આવી જશે કે આજના કેન્દ્રીય સમાજના આગેવાનો કઈ રીતે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

છેલ્લે જ્ઞાતિજનોને નમ્ર નિવેદન છે કે નીચે જણાવેલ મુદ્દાઓ ઉપર ખાસ ધ્યાન આપે.

પૂ.આ.સુ. નારાયણજી રામજી લીંબાણી પ્રેરીત શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદના ઉદ્દેશો અને નિયમો પૈકી પહેલો ઉદ્દેશ અક્ષરસ નીચે પ્રમાણેનો હતો.

'આપણી જ્ઞાતિથી આપણને અલગ પાડી દેનાર તેમજ હિન્દુપણામાંથી આપણને ટાળી દેનાર પિરાણા સતપંથને જ્ઞાતિમાંથી સત્વરે નાબુદ કરવો અને કોઈ પણ જોખમે અને ખર્ચે એ કાર્ય પ્રથમ હાથ ધરવું એ આ સંસ્થાનો (પરિષદનો) મુખ્ય ઉદ્દેશ છે'.

ભટકાયેલ જ્ઞાતિને મુસલમાની ધર્મ તરફ જતાં અટકાવવા અને મૂળ સનાતન વૈદિક ધર્મ તરફ વાળવા માટે આ.સુ.પુ. નારાયણજીબાપા એ ભીષ્મ પ્રતિજ્ઞા નીચે પ્રમાણે લીધેલ હતી.

'મારી હઈયાતીમાં પિરાણાના પાખંડી મતની કણબી જ્ઞાતિમાંથી જડ કાઢી નાખીશ અને તેમ કરતાં જો એ જડ ન નીકળી તો પુનર્જન્મ ધારણ કરીને પણ એ પાખંડી અર્ધદગ્ધ કબ્રસ્તાની પિરાણા ના સતપંથ મતનું જ્ઞાતિમાંથી નિકંદન કાઢી નાખીશ'.

વિચારજો જ્ઞાતિ જનો જરા વિચારજો.

....7

realpatidar.com

realpatidar.com

સુજ્ઞ જ્ઞાતિજનો!

ઉપરોક્ત અમારૂં નમ્ર નિવેદન આપને સત્ય હકિકતોથી વાકેફ કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે. આ નિવેદનનું વાંચન કર્યા બાદ અને તેમાં કરેલ ભલમણો દા.ત. ઉંડાણપૂર્વકનો અભ્યાસ કર્યા બાદ આપને જો સત્યતાની પ્રતિતિ થાય તો આપણી અ.ભા.ક.ક.પા. સનાતન ધર્મ જાગૃતિ સમિતિ આપને કર બધ્ધ પ્રાર્થના કરે છે કે આપનો પ્રતિસાદ સમાજના કર્ણધારોને પત્ર દ્વારા લખીને તેઓને યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુસર આગ્રહભરી વિનંતી કરવા કૃપા કરશોજી. (નોંધ : આપના તરફથી કેન્દ્રીય સમાજને જે પત્ર લખવામાં આવે તેની એક નકલ અમારા નીચે જણાવેલ સરનામા પર મોકલવા કૃપા કરશોજી.)

અ.ભા.ક.ક.પા. સનાતન ધર્મ જાગૃતિ સમિતિ
પત્ર વ્યવહારનું સરનામું :
રમેશભાઈ માવજી વાઘડીયા

R.M. Patel & Co.
Chartered Acountants
350/1, Near Gopalan Arch Mall,
Mysore Road, Bangalore - 560 039.
E-mail : ramanik@poonamtimbers.com
himmatkhetani@gmail.com

realpatidar.com